



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૯/૦૫/૨૦૧૯ બુધવાર

### અમદાવાદ શહેર પોલીસ સમાચાર

#### નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૧૨/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૯ કેસ કરી, ૪૯ વ્યક્તિઓને ઝડપી, ૧૬૦ લીટર દેશી દારૂ, ૨ બોટલ ઈંગ્લીશ દારૂ, ૧ બિયર ટીન અને ૧ સ્ફટક કબજે કર્યું હતું. તેમજ જુગાર ધારા હેઠળ ૮ કેસ કરી ૨૯ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩૦,૬૬૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

#### તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૯૧૩/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૯,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૧૩૧ વ્યક્તિઓની અટકાયત કરી હતી. તેમજ પ્રો.ઈ.૯૩ મુજબ ૩ વ્યક્તિઓની અને પાસા હેઠળ ૫ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

#### છેતરપીંડીની ફરીયાદ:-

સમાચાર યાદી નં.૯૧૪/૧૯

નવરંગપુરા: કમલેશભાઈ દયાશંકર વ્યાસ (રહે.સહજ સેફાયર એ.પી.એમ.સી.યાર રસ્તા પાસે જીવરાજ પાર્ક) એ તા.૨૮/૫/૧૯ નારોજ નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે ઓગષ્ટ-૨૦૧૬ થી ફેબ્રુઆરી-૨૦૧૮ સુધીના સમયગાળા દરમ્યાન આરોપી (૧) સૌરભ દિનેશચંદ્ર પરીખ (રહે. મેઘાન્સ હબીતાત ડી-માર્ટ સ્ટોરની બાજુમા જીવરાજ પાર્ક) (૨) પ્રકાશ મણીલાલ પ્રજાપતિ (રહે. નારાયણ દર્શન સોસાયટી નિલકંઠ મહાદેવ મંદિર પાસે સ્ટર્લીંગ સીટીની અંદર બોપલ) (૩) વિક્રમસીંગ તોમર (રહે. હિરાનગર શીતલામાતાના મંદિરની બાજુમા જુની છાવણી ગ્વાલીયર) (૪) પરીક્ષીતભાઈ પટેલ (રહે. સીલ્વર ગાર્ડનીયા ગોતા ઓવરબ્રીજની બાજુમાં જેની ઓફીસ ૨૨૬/૨૮ બીજનેશ સ્કવેર ,સેમસંગ ફોનવાલે શોરૂમની ઉપર આશ્રમ રોડ) એ ભેગા મળી આશ્રમ રોડ, જુની આર.બી.આઇ બેંકની સામે આવેલ આત્મા હાઉસમા ઓફીસ નંબર- ૯૦૭ તથા ૩૦૬ કીપ ઇન્ફાસ્ટ્રક્ચર નામની ઓફીસ ખાતે ગ્રાહકોના એફ.ડી. તેમજ રીકરીંગ ખાતા ખોલાવી કમલેશભાઈ તથા જગદીશભાઈ ચૌહાણના ગ્રાહકોના કુલ રૂપિયા ૫,૭૬,૦૦૦/- રોકાણ કરાવી વ્યાજ કે મુદલ રકમ પરત નહી આપી કંપની બંધ કરી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઈ.શ્રી એસ.એચ.મિસ્ત્રી ચલાવે છે.

**નારોલ:** ચીન્મય રાજકુમાર ગર્ગ (ઉ.વ.૨૩) (રહે. પ્રેસટીઝ બંગલોઝ યશ બંગલોઝ સામે પુનીતનગર ઘોડાસર) એ તા.૨૮૫/૧૯ નારોજ નારોલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે માહે સપ્ટેમ્બર/ઓક્ટોબર ૨૦૧૮ દરમ્યાન આરોપી અહરનાથ ટેક્ષ ફેબ એક્ષપોર્ટના ડાયરેક્ટર (૧) પન્નાલાલ ઉર્ફે પંકજ માલવીયા (રહે. દેવ પ્રાઇમ એપાર્ટમેન્ટ માનસરોવર લેડમાર્ક સોસાયટીની બાજુમા આઇ.ઓ.સી રોડ ચાંદખેડા) (૨) અશોક ઉર્ફે આલોક સ/ઓફ નેનચંદ બાફના (રહે. રાજપેરેડાઇઝ અંધેરી ઇસ્ટ મરોલ નાકા મુંબઇ (૩) ગુલઝારીલાલ (પુરા નામઠામની ખબર નથી) અને (૪) મધુબહેન અશોક ઉર્ફે આલોક એ ભેગા મળી નારોલ ચંદ્રા ફેશન એકઝીમ નામની કાપડ વેચવાની ફેક્ટરી ૧૮ સુદામા એસ્ટેટ ખાતે આવી વેપારી તરીકે સંબંધો કેળવી ઓફીસની માહિતી આપી વિશ્વાસ ભરોસો કેળવી અવાર-નવાર જુદી-જુદી જાતના કાપડ કિમત રૂપિયા ૩૧,૧૩,૧૩૦/- ઓર્ડર આપી ખરીદ કરી નાણાં નહી આપી વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.આર.અમલીયાર ચલાવે છે.

**ધરફોડ:-**

**સમાચાર યાદી નં.૯૧૫/૧૯**

**માધવપુરા:** રજનીભાઇ નટવરલાલ શાહ (રહે.કલ્યાણનગર સોસાયટી ફાયર સ્ટેશન પાસે શાહપુર દરવાજા બહાર) એ તા.૨૮/૫/૧૯ નારોજ માધવપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૫/૫/૧૯ રાતના ૮/૩૦ થી તા.૧૬/૫/૧૯ કલાક ૪/૩૦ વાગ્યા દરમ્યાન શાહપુર ફાયર સ્ટેશનની સામે આવેલ શાંતિનાથ દેરાસરના દરવાજાનુ તાળુ તોડી અજાણી વ્યક્તિ દેરાસરમાંથી ચાંદીના છત્ર, ચાંદીના હાર, ચાંદીના દોરા મળી કુલ કિમત રૂપિયા ૬૦,૦૦૦/- મત્તાની ચોરી કરી લઈ ગઈ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.ડી.બારોટ ચલાવે છે.

**લુંટ:-**

**સમાચાર યાદી નં.૯૧૬/૧૯**

**વાસણા:** માયાબહેન વા/ઓ જયેશભાઇ શાહ (રહે.વાસુપુજ્ય કોમ્પલેક્ષ એલ.આઇ.સી ઓફિસ સામે વાસણા) તા.૨૬/૫/૧૯ રાતના ૧૦/૪૫ વાગ્યાના સુમારે દેવ હોસ્પિટલ સામે પ્રીયંકા ફ્લેટ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે એક મોટર સાયકલ ઉપર આવેલ બે પુરૂષ માયાબહેનના ગળામાંથી સોનાની ચેઇન કિમત રૂપિયા ૩૦,૦૦૦/- ખેચી લુંટ કરી નાસી ગયા હતા. આ અંગેની ફરીયાદ માયાબહેન શાહે તા.૨૮/૫/૧૯ નારોજ વાસણા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી છે. આ ગુનાની તપાસ વુ.પો.સ.ઇ.શ્રી યુ.આર.ભટ્ટ ચલાવે છે.

**ચોરી:-**

**સમાચાર યાદી નં.૯૧૭/૧૯**

**ખોખરા:** પ્રધ્યુમનભાઇ ભોગીલાલ કાપટેલ (ઉ.વ.૪૩) (રહે.સ્નેહ માંગલ્ય સુર્યમગીન પાસે આર.ટી.ઓ રોડ વસ્ત્રાલ) એ તા.૨૮/૫/૧૯ નારોજ ખોખરા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૦૫/૧૯ બપોરના ૧/૦૦ વાગ્યાના સુમારે સીટીએમ ચાર રસ્તાથી હાટકેશ્વર તરફ જવાના રોડ ઉપર આવેલ સાંઇનાથ ઓટો નામની દુકાન આગળ એક મોટર સાયકલ ઉપર આવેલ ત્રણ અજાણ્યા પુરૂષો પ્રધ્યુમનભાઈ નજીક આવી કહેલ કે તમારા કપડાં ઉપર ગંદુ પડ્યુ છે તેમ કહેતા પ્રધ્યુમનભાઈ ગંદુ સાફ કરતા હતા ત્યારે નજર ચુકવી પ્રધ્યુમનભાઈ પાસેની બેગ ચોરી કરી લઈ નાસી ગયા હતા. બેગમાં રોકડ રૂપિયા ૨,૬૨,૧૬૦/- હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી આર.પી.મકવાણા ચલાવે છે.

આત્મહત્યા:-

સમાચાર યાદી નં.૯૧૮/૧૯

સાબરમતી: લીલાબહેન યુનીલાલ ચૌડાગર (ઉ.વ.૭૭) (રહે.વિશ્વાસ ટેનામેન્ટ જી.એસ.ટી ફાટક પાસે ન્યુ રાણીપ) એ અગમ્ય કારણસર તા.૨૮/૫/૧૯ નારોજ પોતાના ઘરે લોખંડની ઝાળી સાથે સાડી બાંધી ગળેફાસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગે સાબરમતી પોલીસે અકસ્માત મોત નોંધી આ અંગેની તપાસ હે.કો.શ્રી રમણજી રામાજી ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,  
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.  
પોલીસ કમિશનર વતી.